



પોલીસ કમિશનરની કચેરી, સુરત શહેર.
 પોલીસ ભવન, અઠવાલાઇન્સ, સુરત શહેર-૩૮૫૦૦૧
 વિશેષ શાખા, કચેરી ટેલીફોન-૦૨૬૧ ૨૨૪૯૧૧૧૦
 કંદ્રોલ રૂમ ફેક્સ નં. ૦૨૬૧ ૨૨૪૯૩૦૪
 e-mail : special.cp.sur@gmail.com



એક કદમ સચ્છ્લો કોણો

-:: ફોજદારી કાર્યરીતી અધિનીયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ તથા

જી.પી.એક્ટ કલમ ૩૭(૪) અનુયો કાઢેલ કરફયુ હુકમ.

ક્રમાંક: એસ.બી./કોરોના વાયરસ/૦૩/૨૦૨૧

વંચાણે લીધા:-

(૧) ગુજરાત સરકાર, ગૃહવિભાગ, સચિવાલય, ગાંધીનગરના ક્રમાંક : જીજી/૭૫/૨૦૨૦/વી-૧/કઅવ/ ૧૦૨૦૨૦ /૪૮૨ તા. ૩૧/૧૨/૨૦૨૦ આધારે.

સમગ્ર દેશમાં COVID-19 ની અસરોને ધ્યાને લેતા ગેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા. ૨૮/૧૨/૨૦૨૦ ના હુકમ ક્રમાંક: 40-૩/૨૦૨૦-DM-I(A) થી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા. ૨૫/૧૧/૨૦૨૦ ના હુકમની અવધિ તા. ૩૧/૦૧/૨૦૨૧ સુધી લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે. આથી કન્ટેન્મેન્ટ ઓનમાં તા. ૩૧/૦૧/૨૦૨૧ સુધી લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે. તથા કન્ટેન્મેન્ટ ઓન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે.

. ભારત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ તેમજ ધી એપેક્સેડમીન્ટ ડીસીઝ એક્ટ ૧૯૯૭ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરીટી (એન.ડી.એમ.એ) ધ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. હાલમાં સુરત શહેરમાં તહેવારના સમય દરમ્યાન બજારોમાં ખૂબ જ ભીડ જોવા મળેલ તેમજ હરવા ફરવાની તથા ખાણી પીણાની જગ્યાઓ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એક્ટા થતા હોય છે. હાલમાં શિયાળાની ઝતુનો પ્રારંભ થયેલ છે. આ બધા કારણોસર કોરોના સંકમણ વધુ ન ફેલાય તે હેતુસર લોકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને જાહેર જનતાના હિતમાં ફોજદારી કાર્યરીતી અધિનીયમ સને ૧૯૭૩ ની કલમ ૧૪૪ અનુયો પગલાં લેવા માટે અને પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં લઈ જાહેર જનતાના હિતમાં નીચે મુજબનો હુકમ કરું છું.

વાસ્તે, હું અજયકુમાર તોમર (આઇ.પી.એસ.) પોલીસ કમિશનર, સુરત શહેર ફરમાવું છું કે, તા. ૦૧/૦૧/૨૦૨૧ થી તા. ૧૪/૦૧/૨૦૨૧ દરમ્યાન રાત્રિના કલાક ૨૨/૦૦ થી સવારના કલાક ૦૬/૦૦ સુધી સુરત શહેર કમિશનર વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહિ, તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉલા રહેવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહીં.

નિયત વિસ્તાર:-

સુરત શહેર પોલીસ કમિશનર હુકમત હેઠળનો સમગ્ર વિસ્તાર.

અપવાદ :-

નીચે જણાવેલ સેવાઓ સાથે સંકળાવેલ વ્યક્તિત્વો/સંસ્થાઓને ઉપરોક્ત હુકમ પાલનમાંથી મુક્ત આપવામાં આવે છે.

- જાહેર ઉપયોગિતા જેવી કે, પેટ્રોલિયમ સી.એન.જી., એલ.પી.જી., પી.એન.જી., પાણી, સ્વરચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એક્ટ, ટેલિ કોમ્યુનિકેશન સર્વિસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજન્સી.
- પોલીસ, હોમગાર્ડ, સીવીલ ડીફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સરંક્ષણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, જેલો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આવશ્યક સેવાઓ.
- જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સેવાઓ તથા ઇ-કોમર્સ ધ્વારા, ફાર્માસ્યુટિકલ હોમ ડિલવરી.

4. દૂધ વિતરણ
5. ઇલેક્ટ્રોનિક મિડીયા અને પ્રિન્ટ મિડીયા. (માહિતી ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત)
6. ખાનગી સિક્યુરિટી સેવાઓ.
7. આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટીકલ તથા જે ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડે છે.
8. અંતિમ સંસ્કારના કિસ્સામાં વીસ જેટલા વ્યક્તિત્વો ભેગા થઇ શકે તે રીતે પરવાનગી આપી શકશે.
9. લગ્ન પ્રસંગમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી અનુસાર.
10. રેલ્વે અને એરપોર્ટ પર માલસામાનની હેરફેર માટેની પ્રવૃત્તિઓ.
11. રેલ્વે અને હવાઇમાર્ગ અવર-જવર કરનાર મુસાફરોને લેવા તથા મુકવા માટે માન્ય ટિકિટ રજુ કરેથી મંજૂરી માટે ટેક્સી તથા રેડિયો કેબ સેવાઓ ચાલુ રહેશે.
12. બહારગામથી લાંબી મુસાફરી કરી સુરત શહેર માં આવતા મુસાફરોએ પોતાની પાસે રહેલ ટોલટેક્ષ રીસીપ્ટ તથા અન્ય પુરાવા રજુ કરવાના રહેશે.
13. ATM બેન્કીંગ ઓપરેશનના IA વેન્ડરો સહિત, ATM ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ.
14. તમામ પ્રકારના માલસામાનનું પરિવહન.
15. NIC Scientist-B, CGL Tier-3, CSIR NET Exam, CA, SSC વિગેરે અન્ય માન્ય પરીક્ષાઓ આપવા જતા પરીક્ષાર્થીઓને માન્ય પ્રવેશપત્ર / ઓળખપત્રના આધારે લેવા તથા મુકવા જવા માટેની મંજૂરી.
16. ભારત સરકારના તથા ગુજરાત સરકારના વખતોવખતના સુધારા આદેશોને આધીન અપવાદો.
17. પોલીસ કમિશનરશી, સુરત શહેરનાઓ તરફથી ફરજના ભાગરૂપે અનિવાર્ય સંજોગોમાં આવવા-જવા માટે ખાસ પરવાનો આપવામાં આવેલ હોય તેવા વ્યક્તિત્વો.
18. ઉપરોક્ત તમામ છુટછાટો સોશીયલ ડિસ્ટન્સિંગ, ફેસ કવર, હેન્ક સેનીટાઇઝેશન વિગેરે સંબંધમાં COVOD-19 ની માર્ગદર્શક સુચનાઓનું યુસ્તપણે પાલન કરવાની શરતે આપવામાં આવે છે.

-શિક્ષા:-

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફેજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, અને લાગુ અન્ય કાનૂની જોગવાઈઓ સહિત, The Disaster Management Act, 2005 ની કલમ ૫૧ થી ૬૦ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.


-જહેર વિજાપન:-

હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જહેરાત ઉપર જણાવેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલ ચોંટાડી, લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાહી અને ફૂરદર્શન કેન્દ્રો ઉપરથી પ્રસીધ્ય કરાવવું.

આ હુકમ અન્વયે સુરત કમિશરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજાના કોઇ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ફેજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, અને લાગુ અન્ય કાનૂની જોગવાઈઓ સહિત, The Disaster Management Act, 2005 મુજબ ફરીયાદ માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ મારી સહી અને સિક્કા કરી આપેલ છે.




(અજયકુમાર પટેલ)
પોલીસ કમિશર,
સુરત શહેર.

પ્રતિ,

- (૧) અધિક પોલીસ કમિશરશ્રી, સેકટર-૧,૨ સુરત શહેર.
- (૨) અધિક પોલીસ કમિશરશ્રી, ટ્રાફિક એન્ડ કાઇમ સુરત શહેર.
- (૩) નાયબ પોલીસ કમિશરશ્રી, તમામ,સુરત શહેર.
- (૪) મદદનીશ પોલીસ કમિશરશ્રી, તમામ સુરત શહેર.
- (૫) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુરત શહેર.(નકલો ચોટાડી લાઉં સ્પીકર, વાહન ધ્વારા જાહેરાત કરાવવા સારુ)
- (૬) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુરત શહેર.
- (૭) કંટ્રોલ ઈન્ચાર્જશ્રી, સુરત શહેર(તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સર્વિનય નકલ રવાના :-

- (૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૨) પોલીસ મહાનિરેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગર.
- (૩) અધિક પોલીસ મહાનિરેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગર.
- (૪) પોલીસ કમિશરશ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર/વડોદરા શહેર.
- (૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત રેઝ, સુરત.
- (૬) કલેક્ટરશ્રી, સુરત શહેર.
- (૭) મ્યુનિસિપલ કમિશરશ્રી, સુરત શહેર
- (૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટે.) સુરત રીજિયન, સુરત
- (૯) પોલીસ અધિક્ષકશ્રી, સુરત રૂરલ.
- (૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગર.
- (૧૧) જીલ્લા સરકારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુરત.
- (૧૨) મેનેજરશ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિદ્ધ કરવા સારુ).
- (૧૩) પો.ઇન્સ.શ્રી, સુરત રેલ્વે પો.સ્ટે.
- (૧૪) રજુસ્ટ્રારશ્રી, હાઇકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
- (૧૫) રજુસ્ટ્રારશ્રી, ડીસ્ક્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સુરત .
- (૧૬) રજુસ્ટ્રારશ્રી, ચીક જયુડીશ્યલ મેજુ.શ્રી કોર્ટ, સુરત.
- (૧૭) વધારાના એકગીક્યુટીવ મેજુ.શ્રી, સુરત શહેર.(નાનપુરા બહુમાળી સુરત)
- (૧૮) સબ ડીવીઝનલ મેજુ.શ્રી, સીટી પ્રાંત. (જીલ્લા સેવા સંદર્ભ અઠવાલાઇન્સ સુરત
- (૧૯) સંયુક્ત માહિતી નિયામકશ્રી, સુરત (સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિદ્ધ કરવા સારુ.)